



## ૫. ખામી ઓળખવાની ચાવીઓ

ઇંડમાં પોષકતત્ત્વોની એક સમતૂલા હોય છે. જ્યાં સુધી જમીનમાથી મળતા પોષકતત્ત્વો દ્વારા તે જળવાઈ રહે ત્યાં સુધી ઇંડ સામાન્ય સ્થિતીમાં રહે છે. જ્યારે પોષકતત્ત્વોની માત્રા એકાએક ઘટી પડે ત્યારે ઇંડની દેહધાર્મિક ક્રિયાઓમાં અવ્યવસ્થા ઉભી થાય છે. આ અવ્યવસ્થા સકમાંક બનીને ઇંડની પેશી અને આકાર વિદ્યામાં પ્રતિબિંબિત થાય છે. તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પોષકતત્ત્વોની ખામીનું ચિન્હ કહેવાય છે.

સુક્ષમતત્ત્વોની ખામી ઓળખવાનો કોઈ રામબાળ ઈલાજ નથી. જમીનનાં પૃથ્વેકરણ કંઈક અંશે આ બાબતોનો ખ્યાલ આવી શકે, પણ દરેક ખેડૂત માટે તે શક્ય નથી. વળી, સુક્ષમતત્ત્વોની ખામીને ઓળખવાનું સૌથી સચોટ અને વ્યવહારું સાધન ઇંડ પોતે જ છે. અમુક ઇંડમાં કેટલાક પોષકતત્ત્વોની ખામી સૌથી પહેલી નજરે પડે છે. આમ કોઈ એક પોષકતત્ત્વની ખામી પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ પાકને તે પોષકતત્ત્વનો દર્શક પાક કહેવાય છે. દરેક પાક એ જે તે સુક્ષમતત્ત્વની જમીનમાં ખામી નક્કી કરવાનું સૌથી વિશ્વાસપાત્ર અને સરળ ઉપાય છે. સુક્ષમતત્ત્વો માટે તેના કેટલાક દર્શક પાકો અહીં કોઈા—૧ માં આપ્યા છે.

### કોઈા—૧ સુક્ષમતત્ત્વની ઉષાપની અસર ઝડપથી દેખાય તેવા પાકો

તત્ત્વ	ધાર્ય વર્ગ	તેલીબિયા	શાકભાજી તથા અન્ય પાકો
જસત	મકાઈ, ડાંગર, જુવાર	સોયાબીન	વટાણા, લીબુ, સંતરા, કપાસ
લોહ	જુવાર	સોયાબીન, મગફણી	લીબુ, ટામેટો
મેગેનીઝ	જુવાર, ઘઉ	સોયાબીન	વાલ, વટાણા, બટાટા, ઝુંગણી
તાંબુ	ડાંગર, ઘઉ, જવ	—	ઝુંગણી, ૨જકો, તમાકુ, લીબુ
બોરોન	—	મગફણી, રાઈ, સૂર્યમુખી	૨જકો, કપાસ, બટાટા, કોબીજ, ફિલાવર
મોલિબ્ડનમ	—	સોયાબીન	વટાણા, કોલીફિલાવર, ૨જકો, કોબીજ

દર્શક પાકો પર તત્ત્વોનાં જે ચિન્હો જોવા મળે તેની સ્પષ્ટ ઓળખ અગત્યની છે. ઇંડમાં સુક્ષમતત્ત્વોની ઓળખનાં ચિન્હો કોઈા—૨માં આપેલ છે.

સુક્ષમતત્ત્વોની ખામીથી તેના ચિન્હો પ્રદર્શિત થતા આ ખામીની પૂર્તિ ન થાય તો પાક અમુક પ્રકારનાં રોગો પ્રત્યે સંવેદનશીલ બની જાય છે. દરેક સુક્ષમતત્ત્વની ઉષાપથી અમુક પાકમાં જ ખાસ પ્રકારનાં રોગો લાગતા હોય છે. જેની વિગતવાર માહિતી કોઈા—૩ માં આપી છે. આ રીતે આવેલ રોગોનો ઉપયાર રોગનાશક દવાઓ કરતા જેની ખામી હોય તે સુક્ષમતત્ત્વની પૂર્તિ કરવાથી સરળ પડે. પાકમાં જ્યારે પોષકતત્ત્વોની ખામી ઉભી થાય ત્યારે તેમાં એક અથવા બે કે ત્રણ પોષકતત્ત્વોની ખામી એક સાથે પણ ઉભી થઈ શકે પરંતુ, દરેક પોષકતત્ત્વો પોતાની લાક્ષ્મણિક રીતે જ ખામીનું



ચિન્હ પ્રદર્શિત કરે છે. આને અનુલક્ષીને પોષકતત્વોની ખામી પાકનાં વર્ગ પ્રમાણે બદલે છે. પરંતુ પાક કે તેના વર્ગને નિરપેક્ષ રહીને પણ જે તે સૂક્ષ્મતત્વની ખામીને સ્પષ્ટપણે અલગ તારવી શકાય છે. તે માટે સૂક્ષ્મ તત્વોની ખામીને ઓળખ માટે અહીં સામેલ ચાર્ટ ઉપયોગી થશે.

છોડે પ્રદર્શિત કરેલા ખામીનાં ચિન્હો પરથી કયા પોષક તત્વોની ખામી છે તેની ઓળખ વિષયની ઉરી સમજ અને પ્રત્યક્ષ અનુભવ માંગી લે છે. પાકોમાં જોવા મળતી વિકૃતિઓનું અવલોકન, જમીન અને તેનો તુલનાત્મક અભ્યાસ જરૂરી છે. જ્યારે કોઈ પાક જોડે આપણે વર્ષોથી પનારો પડયો હોય ત્યારે તેમા ઉભી થતી કોઈપણ નાની મોટી ક્ષતિને અવગાણવી જોઈએ નહીં. આપણી સગી આંખે દેખાય તે અવસ્થાએ કોઈ ચિન્હ છોડ પર પ્રદર્શિત થાય ત્યાં સુધીમાં છોડે કેટલીયે તકલીફ વેઠી લીધી હોય છે અને આમ પોષકતત્વોની ખામીનું ચિન્હ પ્રદર્શિત થઈ ગયા પછી પણ ખેડૂત આંખ આડા કાન કરે તો તેની તેના વ્યવસાય પ્રત્યેની બેદરકારી છે, તે બરબાદીનો પાયો છે. તે વ્યવસાય પ્રત્યેની એટલી ચાહના ઓછી છે તેમ કહેવાય.

આખા ખેતરનું નિરક્ષણ કરતા હોઈએ ત્યારે પોષકતત્વોની ખામીઓ મહદઅંશે અમુક ગુંડાળામાં જોવા મળશે. મોટે ભાગે નિયાણ કે ઉચાણવાળા ભાગનાં છોડમાં તે પ્રદર્શિત થઈ જાય છે. અથવા તો અગાઉના પાકની જમીન, ખાતરની ઉથરેટી કે કૂચાનો ઢગલો કે પાણીની નીકો અથવા બેઠું ધોવાણ થતું હોય તેવા ભાગમાં પોષકતત્વોની ખામી પ્રથમ નજરે પડે છે.

એક વખત સુક્ષ્મતત્વોની ખામી જણાય તો તેમા ખામી યુક્ત પોષકતત્વનું અનુમાન કર્યા પછી તે જમીન, છોડ બંનેને પ્રયોગશાળામાં પૃથ્વીકરણ માટે મોકલવા. આમ પ્રયોગશાળાનાં પરિણામો જોડે આપણા અનુમાનને સરખાવવું. જો આવા પૃથ્વીકરણ સમયસર ન થાય તો સંભવિત ખામીવાળા સુક્ષ્મતત્વોની જમીન/ છોડમાં પૂર્તિ કરવી. જો ખામીનાં ચિન્હો દૂર થાય તો તે અનુમાનિત સુક્ષ્મતત્વોની જ ખામી હતી તે પ્રતિપાદિત થાય છે. વિવિધ પોષકતત્વોની ખામીનાં નિવારણ અંગેની વિસ્તૃત માહિતી આ શ્રુંખલા અંતર્ગત અન્ય લેખમાં આપેલી છે.

#### કોઠો-૨ છોડમાં સુક્ષ્મતત્વોની ખામીનાં ચિન્હો

છોડમાં જુદા જુદા ભાગોમાં ખામી	મેળેનીજ	જસત	તાંબુ
મૂળ	રૂંધાયેલ મૂળ વૃદ્ધિ	મૂળનો નાશ થવો.	પટ્ટી જેવા સંયુક્ત મૂળ
	મૂળનું શાટવું	મૂળ ઉપમૂળમાં શંકુ આકારનાં સોજા	
	ગુંથાઈ જવું		
પ્રકાંડ	ફીકડી અગ્રકલિકા	કક્ષ કલિકાઓની નબળી વૃદ્ધિ	ઓછી ફૂટ પડવી
	ટુંકુ પાતળું નબળું પ્રકાંડ	નબળી આંતરગાંઠો	નબળો વિકાસ
		પાતળી ડાળીઓ	ટોચ રહિત છોડ
		બહુપ્રકાંડતા	જુર્સાદાર પીલા
		વિકૃત વૃદ્ધિ	પર્ષાપાત
		ટોચથી સુકાવવાની શરૂઆત	ટોચથી સૂકાવું



ગુજરાત સરકાર

પેશીઓ	લંબોતલ પેશી નાની અને પાતળી રહે	કોષ કેન્દ્રમાં સઘન કોષરસ રહે	કોષ દિવાલનું ફાટી જવું
	કંઝી રહીત રંજક દ્રવ્યો	કોષ વિભાજનનું અટકવું.	સ્થૂલ કોષકનું ફાટી જવું.
		વર્ધનશીલ પેશીઓમાં ખાલીપો ઉભો થવો.	હરીતકણોનું ઓછું થઈ જવું.
		પૂરક પેશીઓનું ગંઠાઈ જવું.	રંજક દ્રવ્યકણો વધુ રંજીત થવા.
		લંબોતલ પેશીઓ પહોળી, લાંબી અને પાતળી થઈ જવી.	પર્ણ રંગો નીચે ખાલી થવા.
			પ્રકંડની છાલ ફાટી તેમાથી ગુંદર નીકળવો.
પણો	ટોચનાં પણો ખુલી શકતા નથી.	પણોમાં ભૂખરા ટપકા પડવા.	પર્ણની ટોચ પીળી પડવી.
	ફીકકા ચાંદા	પર્ણ તામ્રવર્ણનાં થઈ જવા.	આંતરમાં શીરામાં પીળાશ.
	મુખ્ય શીરાને સમાંતર સફેદ નસો	આંતરશીરામાં પીળાશ	બહુ પર્ણતા
	ફીકકો, તામ્ર ડાઘાવાળો દેખાવ	પર્ણ—ધનતા	પર્ણની કોર અંદર તરફ વળવી.
	ચાંદાઓ પડયા હોય ન્યા સડો	પર્ણ ધાર ઉપર તરફ વળેલી.	સુકાવું
	વહેલો પણોપાત	નવા પણો બરડ અને વિકૃત	
ફળ અને ફળ	વંદ્ય પુષ્પો	ઓછા પુષ્પ	પૂતળીયાનો નાશ
	પુષ્પકલિકાઓનું પીળું થઈને ખરી પડવું.	વિકૃત બીજધાની	બીજ ન બેસવા, નબળા દાણા
		ફળનાં માવામાં ભૂખરા દાગ	ફળની છાલનું ફાટી જવું.
અન્ય વિકૃતિઓ	જલવાહીની કેલ્શીયમ ઓકઝેલેટથી બુરાઈ જવી.	પીળીયો અને નાના પર્ણનો રોગ	સડામાં ટપકા દેખાવા
	ભૂષણ અથવા ભૂષણકોષમાં કાળા દાગ અથવા પોલાણ, ફીકકાસ અને ડાઘા દૂધી	ફીનોલીક સંયોજનો	ફોલા પરી તેમાથી ગુંદર નીકળવો.
	સડો વહેલો, પર્ણપાત	ફાયટોસ્ટેરોલ તેલ	ઉનાળામાં ટોચથી સુકાવુંને ફરી ઉનાળો પૂરો થયે ટોચ લીલી થવી.
	પાણી પોચા ટપકા, ઝાકળનો રોગ	કેલ્શીયમ, ઓકઝેલેટ અને ટેનીન તેમજ સેન્દ્રિય ફોસ્ફેટનું એકઠા થવું.	



### કોઠો-૩ સુક્ષમતવોની ખામીથી જુદા જુદા પાકોમાં આવતા રોગો

સુક્ષમતવો	ખામીથી થતા રોગોનું નામ	અસર પામતા પાકો
લોહ	પીળીયો	લીબુવર્ગનાં ફળપાકો, મગફળી અને કઠોળ પાકો
મેળોનીજ	સફેદ સુકારો	ઓટ
	તેજસ પીળીયો	ઓટ
	ભૂખરો પીળીયો	ભાજી
	ભૂખરા ટપકા	બટાટા
	પાનમાં ટપકા	ટમેટા, લીબુવર્ગનાં ફળ પાકો
	પાણી પોચા ટપકા	વટાણા
	મૂળનો કોહવારો, પીળીયો	વાલ
	પીળીયો	શેરડી, સોયાબીન
	ભૂખરી શીરા	શેરડી
જસત	બહુ પ્રકાંડતા	સફરજન
	પાનનાં ટપકા	લીબુ વર્ગ
	લધુ પર્ણતા	દ્રાક્ષ, બીજા વૃક્ષો
	કુંમળા પર્ણ પીળાશ	દ્રાક્ષ
	પર્ણની સફેદ ટોચ	મકાઈ
તાંબુ	પર્ણની પીળી ટોચ	ઓટ, ધાન્ય અને કઠોળ
મોલીઝેનમ	ટપકાનો રોગ	ટમેટા
	કોહવારો	ઓટ
	ભૂરો સડો	ઓટ
	ચાબુક અંગારીયો	કોબી ફલાવર
બોરોન	અંદરનો સડો	બીટ, ગુલમહોર
	દાંડા ભૂખરા થવા, થડનું ફાટવું.	કોબીફલાવર
	અંદરનો ટપકા ગેરુ	બટાટા
	પીળી ટોચ	રજકો
	ટોચની રૂગ્ણતા	તમાકુ
	કંદણ ફળ	લીબુ વર્ગ



## કોઠો-૪ પોષકતત્વોની ખામી નકકી કરવાની ચાવીઓ

ધાન્યપાકો		ઉણ્ણપ
(અ.) ધાન્ય પાકો		
ક.	પ્રથમ પાકટ પાંડામાં જોવા મળતા ચિન્હો	
૧.	રતાશ પડતા પાન અને પ્રકાંડ પણ્ણો શરૂમાં ઘેરા લીલા અને ત્યારબાદ ભૂખરા	ફોસ્ફરસ
૨.	ટોચની પીળાશ અને સૂકારો: ટોચને કિનારીની કોર લીલી હોય, વચ્ચેની નસ બાજુથી પાન પીળા પડે છે.	નાઈટ્રોજન
૩.	કોર તરફથી સૂકાવું: પણ્ણો મોટાભાગે પીળા અને ટોચ અને કોર ભૂખરા, છોડનાં પણ્ણો સુકાતા શોય તેમ લટકી પડે.	પોટેશયમ
૪.	પીળી લીટીઓ: શીરાઓની વચ્ચે પીળી લીટીઓ, પછીથી પણ્ણોમાં લીલો ભાગ, નીચે મોતીની માળા સીધી લીટીમાં પડી હોય તેવો આકાર ધારણ કરે.	મેગેનીઝ
૫.	પીળા ડાઘ: પણ્ણોની નીચેના ભાગથી અનિયમિત ડાઘ અને પીળાશ ફેલાવા માંડે.	
ખ.	પ્રથમ તાજા પણ્ણો પર જોવા મળતા ચિન્હો	
૧.	સંપૂર્ણપણે પીળાશ પડતા પાન અને આઢી પીળી નસો.	ગંધક
૨.	પીળાથી સફેદ પીળા પણ્ણો અને લીલી નસો	લોહ
૩.	વિખરાયેલી ટોચ: પણ્ણો ખુલ્લી ન શકે—વીટણાયેલા જોવા મળે.	તાંબુ
૪.	પીળાશ પડતા પણ્ણો અને મૃત અગ્રકલીકાઓ	બોરોન
૫.	ભૂખરા ટપકા સાથે પીળો પાક	ક્રેશયમ
આ. શાકભાજી અને શીલીકુણાં પાકો		
ક.	પ્રથમ જૂના પણ્ણો પર જોવા મળતા ચિન્હો	
૧.	શરૂઆતમાં પણ્ણો ઘાટા લીલા, પછી રતાશ પડતા	ફોસ્ફરસ
૨.	ટોચની પીળાશ: ટોચ તરફથી પણ્ણો પીળાશ પડતા ભૂખરા રંગનાં થવા લાગે છોડ આખો આછા લીલા રંગનો થઈ જાય.	નાઈટ્રોજન
૩.	કોરનું સૂકાવું: ભૂખરી કે કોરવાળા પણ્ણો, લટકી ગયેલા પણ્ણો	પોટેશયમ
૪.	મોટા પીળાશ પડતા ડાઘ	મેનેશયમ
૫.	નાના શુષ્ક ટપકા	ક્રેશયમ
ખ.	પ્રથમ તાજા પણ્ણો પર જોવા મળતા ચિન્હો	
૧.	પીળાશ પડતા લીલા પણ્ણો અને પછી પીળી નસો	ગંધક
૨.	પણ્ણો પીળા અને નસો લીલી	લોહ
૩.	સુકાયેલી અગ્રકલીકાઓ અને પીળાશ પડતા રાતા પણ્ણો	બોરોન
૪.	નાના શુષ્ક ટપકા	જસત
૫.	ચમચી જેવા વળેલા પણ્ણો	મોલીબ્ડેનમ
૬.	સફેદ પણ્ણો	તાંબુ



## ઘઉંના પાકમાં સુદ્ધમતત્વોની ખામીનાં ચિનહો



જસત



લોણ



તાંબુ



મેંગોનીઝ



## મગફળીના પાકમાં સુદ્ધમતત્વોની ખામીનાં ચિનહો



લોહ



જસ્ત



તાંબુ



મેગેનીઝ



## કપાસના પાકમાં સુદ્ધમતત્વોની ખામીનાં ચિનહો



જસત



મેંગોનીઝ



લોણ



તાંબુ



## શેરડીના પાકમાં સુદ્ધમતત્વોની ખામીનાં ચિનહો



લોહ



કોપર



મેંગોનીજ



જસત



## મકાઈના પાકમાં સુદ્ધમતત્વોની ખામીનાં ચિનહે



લોહ



તાંબુ



જસ્ત



મેંગોનીઝ



## કોબીજના પાકમાં સુદ્ધમતત્વોની ખામીનાં ચિનહે



નોરોન



કોપર



લોણ



જસત



## લીંબુના પાકમાં સુદ્ધમતાવોની ખામીનાં ચિનહે



લોણ



ટાંબુ



જસત



મેંગોનીંગ



## ટમેટોના પાકમાં સુદ્ધમતત્વોની ખામીનાં ચિનહો



0.1 B

બોરોન



0.1 Cu

કોપર



-Fe

લોહ



-Zn

જસ્ત